

ઈ-મેઇલ મેસેજ

પ્રતિ :- ડાયરેક્ટરશ્રી, ગુજરાત ઇન્ફોર્મેટીક્સ લી., ગાંધીનગર (gujinfo.gog@gmail.com)

જાણ :- (૧) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા., ગાંધીનગર

(૨) અધિક પોલીસ મહાનિદેશક અને કમિશ્નરશ્રી તકનીકી સેવા, ગુ.રા., ગાંધીનગર

(gswan-conn@gujarat.gov.in)

(૩) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, જૂનાગઢ વિભાગ, જૂનાગઢ

પ્રેષક :- પોલીસ અધિક્ષક, પોરબંદર.

નંબર :- કોમ્પ્યુટર/વેબસાઇટ અપલોડ/૨૦૮/૨૦૨૨, તા.૧૮/૦૪/૨૦૨૨

વિગત :-

સવિનય આપશ્રીની કચેરીના જીસ્વાન મેસેજ નં. જી૧(કાઇમ)/ટે-૨/સારી કામગીરી/૧૭૮૧/૨૦૧૨, તા.૧૭/૦૫/૨૦૧૨ તથા ગૃહ વિભાગ ગાંધીનગરના નં. આઇટી/૧૦૨૦૧૧/૩૦/આઇટી સેલ/૨૦૧૨ તા.૧૨/૦૭/૨૦૧૨ અન્વયે પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૧/૦૪/૨૦૨૨ થી તા.૧૭/૦૪/૨૦૨૨ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય:-

(૧) કિર્તીમંદીર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૮૯/૨૦૨૨ I.P.C. ક.૩૬૩,૩૬૬ તા.૦૫/૦૪/૨૦૨૨ મુજબ અપહરણ થનાર સાનીયાબેન D/O યુસુફભાઇ વાહીદભાઇ ગરાણા ઉ.વ. ૧૬ વર્ષ, ૯ માસ રહે.પંચહાટડી, ખારવાવાડ, પોરબંદરને તા.૧૩/૦૪/૨૦૨૨ના રોજ કિર્તીમંદીર પો.સ્ટે. પો.ઇન્સ.શ્રી બી.ડી.રાઠોડ તથા પોલીસ સ્ટાફના માણસોએ જી.આઇ.ડી.સી., રાજકોટથી શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૫:- વૃધ્ધો મહીલાઓ કે બાળકોની સુરક્ષા માટેની વિશિષ્ટ કામગીરી :-

(૧) તા.૧૧/૦૪/૨૦૨૨ થી તા.૧૭/૦૪/૨૦૨૨ દરમિયાન હાર્બર મરીન પો.સ્ટે. ના સી ટીમના કર્મચારીઓ દ્વારા જાવર અને સુભાષનગર વિસ્તારમાં મોડી રાત્રીનાં મજૂરી પર થી ઘરે જતી મહીલાઓને સી-ટીમ, ડાયલ ૧૦૦ નંબર તથા ૧૮૧ વિશે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ અને કોઈ તકલીફ કે મુશ્કેલી હોય તો સી-ટીમ તથા ડાયલ ૧૦૦ નંબર પર જાણ કરવા સમજ કરેલ. તેમજ ઓડર અને સુભાષનગર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી સીનીયર સિટીઝનની મુલાકાત લેવામાં આવેલ.

મુદ્દા નંબર ૬:- અન્ય લોકહીતની બાબતો જે લોકોને તુરંત જ ધ્યાન પર આવે તેવી બાબતો :-

(૧) તા.૧૪/૦૪/૨૦૨૨ ના રોજ કિર્તીમંદીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઘાયવાડાના નાકા પાસે થી રઘુભાઇને એક બાળકી તેમના કુટુંબીજનો થી અલગ-ભુલી પડી ગયેલ જણાતા તેઓ બાળકીને કિર્તીમંદીર પો.સ્ટે. ખાતે લઈ ગયેલ. જેનું નામ હીયાંસીબેન ઉ.વ.આ. ૫ વર્ષ છે. જેથી તુરંત જ પો.સ્ટે.ઓ દ્વારા PI શ્રી બી.ડી.રાઠોડને જાણ કરતા તેઓશ્રી ની સુચના મુજબ સી-ટીમ WASI જે.એચ.કડછા તથા WHC રમીલાબેન તેજાભાઇ તથા PC દક્ષાબેન મંગાભાઇ એ રીતેના સ્ટાફ દ્વારા તપાસ કરતાં બંગડી બજારમાં આવેલી કિર્તી યા નામની દુકાન પાસે હીયાંસીબેન ના દાદીમાં લતાબેન હરીશભાઇ કોરીયા રહે.કુંભારવાડા, કનૈયા પાનની બાજુમાં, પોરબંદર વાળા મળી આવતા તેઓની પુછપરછ કરી હીયાંસીબેનને તેઓને સોંપવામાં આવેલ.

(૨) તા.૧૩/૦૪/૨૦૨૨ ના રોજ લોકરક્ષક અનોપસિંહ ભાવુભા PCR ઇન્યાર્જ તથા ASI એસ.જી.નકુંમ PCR ડ્રાઇવરની ફરજ પર હતા અને પો.સ્ટે. વિસ્તારમાં PCR વાહન સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ગાયત્રી મંદિર નજીક રસ્તા ઉપર પહોંચતા ત્યા બે નાની બાળકીઓ રડતી જોવામાં આવતા તુરંત જ PCR વાહન રોકી બન્ને બાળકીઓની પુછ-પરછ કરતા પોતે પોતાના પરીવારજનો વિષે કોઇ માહિતી આપી શકતી ન હોય અને સતત રડતી હોય જેથી ગાયત્રી મંદિર આજુબાજુનાં વિસ્તારમાં આ બાળકીઓને સાથે લઇ જઇ તપાસ કરતા આ બાળકીઓના પરીવારજનોની ભાળ ન મળતા તેઓને પો.સ્ટે. લાવી પો.સ.ઈ. શ્રી એસ.એ.સોલંકીને પરિસ્થિતીથી વાકેફ કરતા બન્ને બાળકીઓને નાસ્તો આપી શાંતવના આપી. આ બન્ને બાળકીઓના પરીવારજનોને શોધવા માટે સોશયલ મિડીયાનો ઉપયોગ કરી આ બન્ને બાળકીઓના પરીવારજનો મળી આવતા જેમા ચીમનભાઇ રવજીભાઇ નાયક મુળ-મહેસાણા, શિવરાજપુર ગામ વાળાની ચાર વર્ષની દિકરી કાજલ ઉર્ફે બોળી તથા બીજી બાળકી ભુરા જયંતી નાયકા પંચમહાલ, ગોધરા, કળજાઇ ગામ, વાળાની ત્રણ વર્ષની દિકરી ભાવના હોવાનું જણાઇ આવતા બન્ને બાળકીઓને તેઓના પરીવારજનોને સોંપવામાં આવેલ.

જે આપશ્રીને વિદિત થાય.

(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ. અને
નોડલ ઓફીસર eGujcop
પોરબંદર